

એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી યોજના(ISEL)

(ઠરાવ ક્રમાંક પરચ-૧૦૧૭-૨૨૭૧૪૯-ખ,તા.૦૪/૦૭/૨૦૧૭)

વિદ્યાર્થીઓ માટે ખાસ સુચનાઓ (અરજી વર્ષ ૨૦૨૬-૨૭):-

રાજ્યના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતર માટે આર્થિક સહાય મળી રહે તે માટે દેશ તેમજ વિદેશમાં સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા તમામ વર્ગોના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮થી એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી યોજના(ISEL) અમલમાં મુકેલ છે.

❖ ફેશ વિદ્યાર્થીઓ માટે લાયકાતના ધોરણો:-

૧. ગુજરાત રાજ્યના માન્ય બોર્ડ અથવા માન્ય કેન્દ્રીય બોર્ડની ધોરણ-૧૨ની પરીક્ષા ૬૦ કે તેથી વધુ પર્સેન્ટાઇલ સાથે પાસ કરી દેશ કે વિદેશમાં સ્નાતક કે અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલ હોવો જોઈએ
૨. ગુજરાત રાજ્યની યુનિવર્સિટી/કોલેજ માંથી ડિપ્લોમાની પરીક્ષા ૬૦ કે તેથી વધુ ટકા સાથે પાસ કરી દેશ કે વિદેશમાં સ્નાતક કે અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલ હોવો જોઈએ.
૩. વિદ્યાર્થીના કુટુંબની કુલ વાર્ષિક આવક રૂ.૬ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.
૪. એજ્યુકેશન લોન શિડયુલ બેંકમાંથી જ લીધેલ હોવી જોઈએ. (શિડયુલ બેંકની યાદી <https://isel.gujarat.gov.in/> વેબસાઇટ પર મુકેલ છે)

❖ રીન્યુઅલ વિદ્યાર્થીઓ માટે લાયકાતના ધોરણો:-

૧. વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યા પછીના ક્રમિક શૈક્ષણિક વર્ષમાં વ્યાજ સબસિડીનો લાભ મેળવવા માટે અગાઉ જે વર્ષે વ્યાજ સબસિડી મળી હોય તે પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનું રહેશે.
૨. વિદ્યાર્થી દ્વારા જે વર્ષ માટે રીન્યુઅલ અરજી કરેલ હોય તે વર્ષની વિદ્યાર્થીના કુટુંબની કુલ વાર્ષિક આવક રૂ.૬ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.

❖ સહાયની રકમ:-

૧. શિડયુલ બેંકમાંથી લીધેલ રૂ.૧૦ લાખ સુધીની એજ્યુકેશન લોન પર ૧૦૦% વ્યાજ સહાય મોરેટોરિયમ પિરિયડ (અભ્યાસક્રમનો સમયગાળો + એક વર્ષ) સુધી મળવાપાત્ર છે.
૨. એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી યોજના(ISEL)અંતર્ગત લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને એજ્યુકેશન લોન લીધેલ હોય તે તારીખથી ૩૧ માર્ચ સુધીનું (મોરેટોરિયમ પિરિયડ માટે) રૂ.૧૦ લાખ સુધીની એજ્યુકેશન લોન પરનું ૧૦૦% વ્યાજ સહાય તરીકે

આપવામાં આવે છે, પરિણામે વિદ્યાર્થીના લોન ખાતામાં લોનની તારીખથી ૩૧ માર્ચ સુધીનું વ્યાજ તા.૩૧મી માર્ચ પછી એજ્યુકેશન લોનના ખાતામાં વ્યાજ સહાય તરીકે જમા કરવામાં આવે છે, આથી વિદ્યાર્થીએ જે નાણાંકીય વર્ષમાં એજ્યુકેશન લોન લીધેલ હોય તે નાણાંકીય વર્ષ પૂર્ણ થયા પછી પોર્ટલ શરૂ થયેથી છેલ્લી તારીખ સુધીમાં અરજી કરવાની રહેશે.

૩. વિદ્યાર્થી જો નાપાસ થાય અને/અથવા અભ્યાસ છોડી દેશે અથવા બેંક જાતે જ જો કોઈ કારણસર વિદ્યાર્થીની લોન રદ કરે તો વ્યાજ સબસિડી આપોઆપ બંધ થઈ જશે. જો કોઈ સંજોગોમાં લોનની સંપૂર્ણ ભરપાઈ થઈ જશે તો પણ વ્યાજ સબસિડી આપમેળે બંધ થઈ જશે.

❖ રજીસ્ટ્રેશન માટેની અગત્યની સૂચનાઓ:-

૧. રજીસ્ટ્રેશન કરતા પહેલા અને રીન્યુઅલ અરજી કરતા પહેલા દરેક વિદ્યાર્થીએ **નોટીસબોર્ડ પરની બધી જ સૂચનાઓ અચૂક વાંચી લેવી**. ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરવી.અરજી અંગે કોઈપણ મુશ્કેલી હોય તો છેલ્લી તારીખ પહેલા જ કેસીજી કચેરીનો સંપર્ક કરવો. છેલ્લી તારીખ બાદ આવેલ કોઈપણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહિ.
૨. એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી યોજનાનો((ISEL) લાભ મેળવવા માટે ફેશ અરજી કરનાર વિદ્યાર્થીએ સૌપ્રથમ <https://isel.gujarat.gov.in/> વેબસાઈટ પર “Student Registration”માં જઈ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
 - ૧) વિદ્યાર્થીએ Student Registrationમાં જઈ મોબાઈલ નંબર, ઈ-મેઈલ આઈડી તેમજ Captcha દાખલ કરી “Get OTP” પર ક્લિક કરવાનું રહેશે.
 - ૨) ત્યારબાદ વિદ્યાર્થીને ઈ-મેઈલ અને મોબાઈલમાં પ્રાપ્ત થયેલ OTP દાખલ કરી વેરિફાઈ કરી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
 - ૩) રજીસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીને ઈ-મેઈલમાં User ID અને One Time Password પ્રાપ્ત થશે. આ One Time Password ને જૂના પાસવર્ડ તરીકે ઉપયોગ કરીને પોતાનો જુનો પાસવર્ડ ફરજિયાત બદલવાનો રહેશે.
 - ૪) ત્યારબાદ રજીસ્ટર કરેલ ઈ-મેઈલ આઈડી અને નવો પાસવર્ડ દાખલ કરી “Submit” પર ક્લિક કરવું. રજીસ્ટર થયેલ મોબાઈલ નંબર પર OTP પ્રાપ્ત થશે, જેને દાખલ કરીને લોગ-ઇન કરવાનું રહેશે.

નોંધ: આંતરરાષ્ટ્રીય (International) મોબાઈલ નંબર પર સૂચનાઓ અને OTP પ્રાપ્ત થશે નહિ. તેથી વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન દરમિયાન માત્ર ભારતીય (National) મોબાઈલ નંબરનો જ ઉપયોગ કરવો.

3. વિદ્યાર્થીએ નવો પાસવર્ડ ઓછામાં ઓછા ૮ અક્ષર અને વધુમાં વધુ ૧૬ અક્ષરનો રાખવો. નવા પાસવર્ડમાં ઓછામાં ઓછું એક અપરકેસ, એક લોઅરકેસ, એક નંબરનો અક્ષર, એક સ્પેશિયલ કેરેક્ટર (ઉદા. Abcd@1234) આમ પાસવર્ડમાં આલ્ફાન્યૂમેરિક અને સ્પેશિયલ કેરેક્ટરનું સંયોજન હોવું આવશ્યક છે.
4. વિદ્યાર્થીએ પોતાનો પાસવર્ડ દર ૯૦ દિવસમાં બદલવાનો રહેશે.
5. વિદ્યાર્થીએ જે મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈડીથી રજીસ્ટ્રેશન કરેલું હોય તેને સંપૂર્ણ અભ્યાસક્રમના સમયગાળા દરમિયાન બદલવું નહિ. અગત્યની સૂચનાઓ રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈડી પર આપવામાં આવશે. જો વિદ્યાર્થી રજીસ્ટર્ડ મોબાઈલ નંબર બદલશે કે ઈ-મેઈલ ન જોવે અને સહાયથી વંચિત રહેશે તો તે અંગેની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીની રહેશે.

❖ અરજી સંબંધિત મહત્વપૂર્ણ સૂચનાઓ:

1. ડિપ્લોમા/ધોરણ-૧૨ પાસ કરી વર્ષ ૨૦૨૫-૨૬માં સ્નાતક/અનુસ્નાતક અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવા માટે શિડ્યુલ બેંકમાંથી એજ્યુકેશન લોન લીધેલ હોય અને પ્રથમ હપ્તાનો ઉપાડ નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન કરેલ હોય તેઓએ ફેશ વિદ્યાર્થી તરીકે અરજી કરવાની રહેશે.

જ્યારે ગત વર્ષે એટલે કે ૨૦૨૫-૨૬ના વર્ષમાં કે તેના અગાઉના વર્ષોમાં એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી યોજના(ISEL) હેઠળ વ્યાજ સહાય મેળવેલ હોય અને ધારાધોરણો સંતોષતા હોય તો તેઓએ વર્ષ ૨૦૨૬-૨૭માં રીન્યુઅલ વિદ્યાર્થી તરીકે અરજી કરવાની રહેશે.

વિદ્યાર્થીની સ્થિતિ (દરજો)	અરજી કરવાનો પ્રકાર
પ્રથમ વર્ષની વ્યાજ સબસિડી મેળવવા અરજી કરતા હોય તેવા વિદ્યાર્થી.	ફેશ
બીજા વર્ષની વ્યાજ સબસિડી મેળવવા અરજી કરતા હોય તેવા વિદ્યાર્થી.	પ્રથમ રીન્યુઅલ
ત્રીજા વર્ષની વ્યાજ સબસિડી મેળવવા અરજી કરતા હોય તેવા વિદ્યાર્થી.	દ્વિતીય રીન્યુઅલ
ચોથા વર્ષની વ્યાજ સબસિડી મેળવવા અરજી કરતા હોય તેવા વિદ્યાર્થી.	તૃતીય રીન્યુઅલ
પાંચમાં વર્ષની વ્યાજ સબસિડી મેળવવા અરજી કરતા હોય તેવા વિદ્યાર્થી.	ચોથું રીન્યુઅલ
છઠ્ઠા વર્ષની વ્યાજ સબસિડી મેળવવા અરજી કરતા હોય તેવા વિદ્યાર્થી.	પાંચમું રીન્યુઅલ
સાતમાં વર્ષની વ્યાજ સબસિડી મેળવવા અરજી કરતા હોય તેવા વિદ્યાર્થી.	છઠ્ઠું રીન્યુઅલ

2. વિદ્યાર્થીએ ડિપ્લોમા/ધોરણ-૧૨ની અસલ માર્કશીટ પ્રમાણે નામ લખવું.
3. વિદ્યાર્થીએ પોતાનો ૧૨ આંકડાનો આધારકાર્ડ નંબર વેરીફાય કરીને જ લખવો.
4. વિદ્યાર્થીએ પોતાના રેશનકાર્ડની માહિતી જેમ કે રેશનકાર્ડ નંબર અને વિદ્યાર્થીનો રેશન કાર્ડ મેમ્બર આઈ.ડી. નંબર ચકાસીને લખવો.
5. જે વિદ્યાર્થીએ ડિપ્લોમા ટુ ડીગ્રીમાં એડમીશન લીધેલ હોય તેવા વિદ્યાર્થીઓએ ડિપ્લોમાનો એનરોલમેન્ટ નંબર લખવો.
6. વિદ્યાર્થીએ ધોરણ-૧૨નો સીટ નંબર અને યુનિવર્સિટીનો એનરોલમેન્ટ નંબર આપતી વખતે કોઇપણ સ્પેસ કે સ્પેશિયલ કેરેક્ટર(ઉદા., . “ ? {}) લખવા નહિ.
7. વિદ્યાર્થીએ પોતાના વાલીનો એક્ટીવ મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈડી પણ આપવાનો રહેશે.
8. જો વિદ્યાર્થીએ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના(MYSY)/માન.મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃત્તિ યોજના(CMSS)/સ્કીમ ઓફ ડેવલપિંગ હાઈ ક્વોલિટી રીસર્ચ(SHODH), ભારત સરકાર, ગુજરાત સરકાર કે સરકાર હસ્તકની અન્ય સંસ્થાઓ પાસેથી સ્કોલરશીપ, શૈક્ષણિક લોન પર વ્યાજ સબસિડી કે અન્ય કોઈ પણ યોજનાનો લાભ લીધેલ ન હોય તો અન્ય યોજનાનો લાભ લીધેલ છે કે નહિ તેમાં “NO” સિલેક્ટ કરવું. સરકારશ્રીની અન્ય કોઈ યોજનાનો લાભ લીધેલ હશે તો આ યોજના હેઠળ લાભ મળશે નહિ.
9. વિદ્યાર્થીએ પોતાના બચત ખાતાની અને લોન ખાતાની માહિતી ખરાઈ કર્યા બાદ જ લખવી.
10. વિદ્યાર્થીએ પોતાના દરેક ઉપાડની રકમ તથા વ્યાજદરની માહિતી ખરાઈ કર્યા બાદ જ લખવી.

ખાસ નોંધ: એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી યોજના(ISEL) અંતર્ગત લાભ મેળવવા લાભાર્થીઓએ અરજી કરતી વખતે દરેક માહિતી સાચી આપવાની રહેશે. જો વિદ્યાર્થીઓ દ્વારા અરજી કરતી વખતે કોઇપણ માહિતી ખોટી આપવામાં આવશે તો આપને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં અને જો કોઈ રકમ સહાય તરીકે મેળવેલ હશે તો ૧૮% ના દંડનીય વ્યાજ સાથે પરત કરવાની રહેશે. ત્યારબાદ આ અંગે સુધારા માટેના ઈ-મેઈલ પણ ધ્યાને લેવામાં આવશે નહીં અને આપની અરજી નામંજૂર થશે તેની નોંધ લેવી.

❖ ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા:-

1. ફેશ વિદ્યાર્થીએ સૌપ્રથમ <https://isel.gujarat.gov.in/> પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
 - જો વિદ્યાર્થીને રજીસ્ટ્રેશન કરવામાં મુશ્કેલી જણાય તો તેમણે isel-kecg@gujgov.edu.in પર ૧) આધાર કાર્ડ ૨) ડિપ્લોમા/ધોરણ-૧૨ની માર્કશીટ ૩) એડમિશન લેટર ઈ-મેઈલ કરવાના રહેશે.

2. ફેશ અરજી કરતા વિદ્યાર્થીઓએ લોગ ઇન થયા પછી “Apply” પર ક્લિક કરીને માંગવામાં આવેલ જરૂરી વિગતો ભરવાની રહેશે અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
3. રીન્યુઅલ વિદ્યાર્થીઓએ સૌપ્રથમ <https://isel.gujarat.gov.in/> પોર્ટલ પર રજીસ્ટર્ડ કરેલ ઈ-મેઈલ આઈડી અને પાસવર્ડ દાખલ કરી રજીસ્ટર મોબાઈલ પર મળેલ OTP થી લોગ ઇન કરવાનું રહેશે.
 - રીન્યુઅલ અરજી કરતી વખતે જે વિદ્યાર્થીને લોગ ઇન કરવામાં મુશ્કેલી જણાય તો તેમણે isel-kcg@gujgov.edu.in પર ૧) આધાર કાર્ડ ૨) ડિપ્લોમા/ધોરણ-૧૨ની માર્કશીટ ૩) એડમિશન લેટર ઈ-મેઈલ કરવાના રહેશે.
 - રીન્યુઅલ અરજી કરતી વખતે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર બદલાઈ ગયો હોય તો વિદ્યાર્થીએ isel-kcg@gujgov.edu.in પર ઈ-મેઈલ દ્વારા જાણ કરવાની રહેશે અથવા નોલેજ કોન્સોર્ટીયમ ઓફ ગુજરાત, PRL સામે, એલ.ડી કોલેજ ઓફ એન્જિનિયરીંગની બાજુમાં, નવરંગપુરા, અમદાવાદ ખાતે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ પહેલા રૂબરૂ મુલાકાત લઈ પોતાનો મોબાઈલ નંબર બદલાવવાનો રહેશે.
4. રીન્યુઅલ માટે અરજી કરતા વિદ્યાર્થીએ લોગ-ઇન થયા પછી પ્રથમ/બીજા/ત્રીજા/ચોથા/પાંચમું/છઠ્ઠું (જે લાગુ પડતું હોય તે વર્ષ) રીન્યુઅલ વિકલ્પ પસંદ કરીને સંબંધિત વિગતો ભરવાની રહેશે અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
5. વિદ્યાર્થીએ પોતાના અસલ અને સ્વપ્રમાણિત દસ્તાવેજો (સુવાચ્ય અને બ્લર ન હોય તેવા) સ્કેન કરીને ઓનલાઈન ફોર્મ સાથે અપલોડ કરવાના રહેશે. દસ્તાવેજ .pdf ફોર્મેટમાં હોય તો મહત્તમ 1.5 MB અને .jpg /.jpeg ફોર્મેટમાં હોય તો મહત્તમ 50 KB સાઈઝમાં હોવા જોઈએ.
6. આ યોજના અંતર્ગત રાજ્યના દરેક જિલ્લામાં એક એમ કુલ ૩૩ હેલ્પ સેન્ટર ઉપલબ્ધ છે. જેની યાદી પોર્ટલ પર ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કર્યા બાદ કામકાજના દિન-૦૭માં પોતાના જીલ્લામાં ફાળવેલ હેલ્પ સેન્ટર ખાતે જઈ અસલ અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે અને અરજી પત્રક અને દસ્તાવેજોની નકલોનો એક સેટ હેલ્પ સેન્ટર ખાતે જમા કરાવવાનો રહેશે. હેલ્પ સેન્ટર ખાતે અરજી જમા કરાવીને **Acknowledgement Receipt** મેળવવાની રહેશે. હેલ્પ સેન્ટર ખાતે અરજીની ચકાસણી કરાવેલ હોય અને તેની **Acknowledgement Receipt** મેળવેલ હશે એજ વિદ્યાર્થીઓની અરજી કમિશનરેટ દ્વારા મંજૂર/નામંજૂર અંગેની આગળની કાર્યવાહી થશે.

➤ અન્ય સૂચનાઓ:

1. જો વિદ્યાર્થી વિદેશમાં અભ્યાસ કરતો હોય તો વિદ્યાર્થીએ આ યોજના માટે અરજી કરતી વખતે તેના વતી વિવિધ દસ્તાવેજોમાં સહી કરવામાં તેના માતા/પિતા પૈકી જેને ઓથોરીટી આપી હોય તેની પાવર ઓફ એટર્ની, આ અરજી મંજૂર/નામંજૂર કરવા અંગેની આગળની કાર્યવાહી માટે માન્ય ગણવામાં આવશે અને વિદ્યાર્થી વતી માતા અથવા પિતા જ સહી કરી શકશે અન્ય કોઈને ઓથોરીટી આપી હશે તો માન્ય ગણવામાં આવશે નહીં.
2. વિદ્યાર્થી વિદેશ અભ્યાસ કરતો હોય તેવા કિસ્સામાં વિદ્યાર્થીના બદલે તેના કુટુંબના કોઈ સભ્ય હેલ્પસેન્ટર ખાતે દસ્તાવેજો રજૂ કરી શકશે. હેલ્પ સેન્ટર ખાતે દસ્તાવેજ રજૂ કરનાર કુટુંબનો જ સભ્ય છે તેની ખાતરી માટે સભ્યે ફરજિયાત રેશનકાર્ડ રાખવાનું રહેશે.
3. એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી યોજના(ISEL) અંતર્ગત અરજી કરવા માટે મામલતદાર/તાલુકા વિકાસ અધિકારી/તલાટી-કમ મંત્રીની કચેરીમાંથી કઢાવેલ માતા-પિતાની આવક દર્શાવતું આવકનું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે.
 - રૂ.૫ લાખ સુધીની આવક માટે જે-તે ગામ/સેજા/જૂથ ગ્રામ પંચાયત ખાતે રહેતા વ્યક્તિ માટે સંબંધિત ગામ/સેજા/જૂથ ગ્રામ પંચાયતના તલાટી-કમ મંત્રી/મામલતદાર/તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવેલ આવકનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે, જ્યારે રૂ.૫ લાખથી વધુ આવક માટે મામલતદાર/તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવેલ આવકનું પ્રમાણપત્ર જ માન્ય ગણાશે.
 - આવકનું પ્રમાણપત્ર તે ઈશ્યુ થયાના નાણાકીય વર્ષ સહીત ૩ વર્ષ માટે માન્ય હોય છે એટલે કે જો આવકનું પ્રમાણપત્ર તા.૧૮/૦૮/૨૦૨૨ એ કઢાવ્યું હોય તો તે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩, ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ માટે માન્ય ગણાશે. એટલે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે આ આવકનું પ્રમાણપત્ર માન્ય ગણાશે નહીં. પરિણામે, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે વ્યાજ સબસિડી મેળવવા માટે આવકનું પ્રમાણપત્ર ૩૧/૦૩/૨૦૨૬ પહેલા નવું કઢાવેલું હોવું જોઈએ. તા.૩૧/૦૩/૨૦૨૬ પછી કઢાવેલ આવકનું પ્રમાણપત્ર માન્ય ગણાશે નહિ. જેની ખાસ નોંધ લેવી.
4. આ ઉપરાંત વિદ્યાર્થીની અરજી અંગે જરૂર જણાય તો સંબંધિત કચેરી વિદ્યાર્થીના પરિણામ, કૌટુંબિક આવકને લગતા કે અન્ય જરૂરી વધારાના દસ્તાવેજો માંગી શકે છે. જે વિદ્યાર્થીએ સમયમર્યાદામાં આપવાના રહેશે. જો ૩ વાર વિગતો માંગવા છતાં વિદ્યાર્થી દ્વારા દસ્તાવેજો જમા કરાવવામાં નહિ આવે તો તેની અરજી રદ કરવામાં આવશે તેની નોંધ લેવી.

5. અગત્યની સૂચનાઓ અને છેલ્લી તારીખને ધ્યાને લઈ વ્યાજ સહાય મેળવવાથી વંચિત ન રહે તે માટે વિદ્યાર્થીએ [દર અઠવાડિયે નિયમિત વેબસાઈટ/ Student Status](#) જોતા રહેવું.

❖ **List of Documents for Fresh Application:-**

- વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો (મહત્તમ 50 KB સાઈઝમાં હોવા જોઈએ)
- વિદ્યાર્થીની સહી (મહત્તમ 50 KB સાઈઝમાં હોવી જોઈએ)
- ડિપ્લોમા અથવા ધોરણ-૧૨ માર્કશીટ (લાગુ પડે તે મુજબ)
- વિદ્યાર્થીનું આધાર કાર્ડ
- રેશનકાર્ડ
- તલાટી કમ મંત્રી/મામલતદાર કે ટી.ડી.ઓ દ્વારા પ્રમાણિત આવકના પ્રમાણપત્રની નકલ. (વાલીનો આવકનો દાખલો)
- વિદ્યાર્થીના રહેઠાણના પુરાવાની નકલ. (પાસપોર્ટ/ડ્રાઈવિંગ લાઈસન્સ/બેંક સ્ટેટમેન્ટ/રેશનકાર્ડ/ટેલીફોન બિલ/લાઈટ બિલ/વોટર આઈડી-પૈકી કોઈ પણ એક)
- બેંક સાથે કરેલ એજ્યુકેશન લોન અગ્રીમેન્ટની બેંક મેનેજરના સહી સિક્કા સાથેની નકલ.
- એજ્યુકેશન લોન સેંકશન લેટરની બેંક મેનેજરના સહી સિક્કા સાથેની નકલ. (નમૂનો/અનેક્ષર પોર્ટલ પર ઉપલબ્ધ છે.)
- એજ્યુકેશન લોન ડીસબર્સમેન્ટ લેટરની બેંક મેનેજરના સહી સિક્કા સાથેની નકલ. (નમૂનો/અનેક્ષર પોર્ટલ પર ઉપલબ્ધ છે.)
- એજ્યુકેશન લોનનો ઉપાડ કર્યો હોય ત્યારથી આજરોજ સુધીનું એજ્યુકેશન લોન ખાતાનું સ્ટેટમેન્ટ.(બેંક મેનેજરના સહી સિક્કા સાથેનું)
- એજ્યુકેશન લોન બેંક-ઇન્ટરેસ્ટ સર્ટીફિકેટ. (વ્યાજ અંગેનું પ્રમાણપત્ર બેંક મેનેજરના સહી સિક્કા સાથે)
- વિદ્યાર્થીના બચત ખાતાની પાસબૂકના પ્રથમ પાનાની નકલ/બચત ખાતાના સ્ટેટમેન્ટનું પ્રથમ પેજ/કેન્સલ ચેક.(પૈકી કોઈ પણ એક)
- એડમિશન લેટર (લેટર જે તે કોલેજ/યુનિવર્સિટીના લેટરહેડ પર હોવું જોઈએ અને કોલેજ દ્વારા માન્ય સહી સિક્કા સાથે હોવું જોઈએ)
- યુનિવર્સિટી કે કોલેજના પ્રથમ વર્ષની કે સેમેસ્ટર પદ્ધતિ હોય તો પ્રથમ બે સેમેસ્ટરની ફી રસીદ
- "અન્ય કોઈ યોજનાનો લાભ લીધેલ નથી" તે અંગેનું સેલ્ફ ડિક્લેરેશન સર્ટીફિકેટ (KCG દ્વારા નિયત કરેલ ફોર્મેટમાં જે વેબસાઈટ પર આપેલ છે)
- પાસપોર્ટની નકલ. (વિદેશ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ માટે જ)

- વીઝા/વીઝા લેટરની નકલ. (વિદેશ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ માટે જ)
- પાવર ઓફ એટર્ની. (વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે જ)

❖ **List of Documents for Renewal Application:-**

- વિદ્યાર્થીનું આધાર કાર્ડ
- રેશનકાર્ડ
- તલાટી કમ મંત્રી/મામલતદાર કે ટી.ડી.ઓ દ્વારા પ્રમાણિત આવકના પ્રમાણપત્રની નકલ. (વાલીનો આવકનો દાખલો)
- એજ્યુકેશન લોનનો ઉપાડ કર્યો હોય ત્યારથી આજરોજ સુધીનું એજ્યુકેશન લોન ખાતાનું સ્ટેટમેન્ટ.(બેંક મેનેજરના સહી સિક્કા સાથેનું)
- એજ્યુકેશન લોન ડીસબર્સમેન્ટ લેટરની બેંક મેનેજરના સહી સિક્કા સાથેની નકલ. (કેસીજીના નિયત કરેલ નમુના પ્રમાણે)
- એજ્યુકેશન લોન બેંક-ઇન્ટરેસ્ટ સર્ટીફિકેટ. (વ્યાજ અંગેનું પ્રમાણપત્ર બેંક મેનેજરના સહી સિક્કા સાથે)
- વિદ્યાર્થીએ પાસ કરેલ બધાજ વર્ષની કે સેમેસ્ટર પદ્ધતિ હોય તો બધા જ સેમેસ્ટરની માર્ક્સશીટ
- યુનિવર્સિટી કે કોલેજના તમામ વર્ષની કે સેમેસ્ટર પદ્ધતિ હોય તો તમામ સેમેસ્ટરની ફી રસીદ

❖ **ક્વેરીમાં મુકેલ અરજીઓ માટે અગત્યની સૂચનાઓ:-**

- જે વિદ્યાર્થીઓની અરજી યોગ્ય દસ્તાવેજો ન હોવાના કારણે ડીપાર્ટમેન્ટ દ્વારા ક્વેરીમાં રાખવામાં આવેલ હોય, તે વિદ્યાર્થીઓએ નીચે મુજબની સૂચના ખાસ ધ્યાને લેવાની રહેશે:
 1. વિદ્યાર્થીઓએ એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી યોજના(ISEL)ની વેબસાઈટ પર જઈને પોતાના આઈડી પાસવર્ડથી લોગ ઇન કરવાનું રહેશે.
 2. વિદ્યાર્થીઓને પોતાના લોગ ઇનમાં “Upload Query Document”માં જઈને ડોક્યુમેન્ટની સામે Remarksમાં ક્વેરી દ્વારા જે દસ્તાવેજો મંગાવવામાં આવ્યા હોય તે જ દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે અને હેલ્પસેન્ટર પર જઈને તેનું ફરજિયાત વેરીફિકેશન કરાવવાનું રહેશે.
 3. વિદ્યાર્થી દ્વારા ૩ થી વધુ વખત ખોટા દસ્તાવેજો અપલોડ કરવામાં આવશે તો પણ તેઓની અરજી રદ કરવામાં આવશે. પરિણામે, એક જ દસ્તાવેજ ફરી અપલોડ કરતા

અરજી ક્વેરીમાં રાખવામાં આવે અને તે દસ્તાવેજ ફરી માંગવામાં આવે તો માર્ગદર્શન માટે જરૂર જણાય તો હેલ્પ સેન્ટર કે સંબંધિત કચેરીએ તાત્કાલિક રૂબરૂ સંપર્ક કરવો.

- તમામ વિદ્યાર્થીઓએ આ વ્યાજ સહાય અંગેની વધુ માહિતી મેળવવા માટે તેમજ મુંઝવણના ઉકેલ માટે નોલેજ કોન્સોર્ટીયમ ઓફ ગુજરાત, PRL સામે, એલ.ડી કોલેજ ઓફ એન્જિનિયરીંગની બાજુમાં, નવરંગપુરા, અમદાવાદ ખાતે **અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ પહેલા** રૂબરૂ મુલાકાત લેવાની રહેશે. છેલ્લી તારીખ બાદ કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહિ જેની નોંધ લેવી.
- યોજનાની વધુ માહિતી કામકાજના દિવસોમાં હેલ્પ લાઈન નં: ૯૯૦૯૦૩૯૩૮૦ (૧૦:૩૦ થી ૧૮:૦૦) પરથી મળી શકશે.